



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૮/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૫૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૮ કેસ કરી, ૭૩ વ્યક્તિઓને ઝડપી, ૧૮૫ લીટર દેશી દારૂ, ૨૫૨ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૭૨ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૧,૨૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૫૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૮૫૭/૧૮

ખાડીયા : હર્ષભાઈ જયંતીભાઈ મોદી (ઉ.વ.૨૫)(રહે, રમ્યકુંજ સોસાયટી પારસનગર, ઇસનપુર વટવા રોડ) એ તા.૨૨/૦૮/૨૦૧૮ નારોજ ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૮/૨૦૧૮ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે માણેકચોક, ધાંચીની પોળમાં આરવ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ “વી.એસ.ગોલ્ડ” નામની દુકાનમાં આરોપી શૈલેશભાઈ ગોવિંદભાઈ ગઢવી (રહે, રામકૃષ્ણપાર્ક, શાંતીપ્રકાશ નગર પરસાણનગર-૦૧ રાજકોટ) એ પોતાનું નામ મુન્નાભાઈ પટેલ હોવાની ખોટી ઓળખ આપી, હર્ષભાઈ પાસેથી સોનાની અલગ-અલગ ડિઝાઈનની ચેઈનો કુલ નંગ-૫૪ કુલ કિંમત રૂપિયા ૨૩,૬૨,૬૨૦/- મતાની તથા આશીષભાઈ શોભારામ પાસેથી સોનાની બંગડી નંગ-૫ અને સોનાની લકી નંગ-૧ કુલ કિંમત રૂપિયા ૭,૧૪,૬૪૨/- મતાની મળી કુલ રૂપિયા ૩૦,૭૬,૮૬૨/- મતાના દાગીના ખરીદ કરવાના બહાને મેળવી લઈ, “પોતાની ઓફીસ નીચે પોતાના માણસ પાસેથી પેમેન્ટ લઈને આવુ છું” તેમ કહી બંનેને વિશ્વાસમાં લઈ, તમામ દાગીના લઈ ઓફીસમાંથી નીચે ઉતરી નાસી ગયેલ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.કે.પાટીલ ચલાવે છે.

કાગડાપીઠ : હીરાબહેન વા/ઓ રવજીભાઈ મકવાણા (ઉ.વ.૫૫)(રહે, એકતાનગર સુતરીયાની ચાલી પાસે મજુરગામ ગીતામંદિર રોડ) એ તા.૨૨/૦૮/૨૦૧૮ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૪ માં આરોપી વિનોદભાઈ ઉર્ફે બીપીનભાઈ શંકરલાલ પરમાર (રહે, ભીમરાવની ચાલી મહાવીર સ્કુલની સામે દાણીલીમડા) એ ઔડાના મકાન આપવાની લાલચ આપી, હીરાબહેન પાસેથી ૧,૫૦,૦૦૦/- તથા તેમની બહેન પાસેથી ૧,૦૦,૦૦૦/-મેળવી લઈ, મકાન નહિ આપી રૂપિયા પણ પરત નહી કરી, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૮૫૮/૧૮

નારોલ : રાજેશભાઈ શ્રીનારાયણભાઈ ઝા (રહે,ચંદ્રલોક બંગ્લોઝ, મંદિર સામે નારોલ) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૯/૧૮ કલાક ૩/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, ઘરમાંથી કેડીટ કાર્ડ નંગ-૦૪ ડેબિટકાર્ડ નંગ-૦૨, સેમસંગ મોબાઇલ ફોન નંગ-૦૩ કુલ કિંમત રૂપિયા ૧૯,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.જી.બ્રિદ યલાવે છે.

સાઈટ ઉપરથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૮૫૯/૧૮

ચાંદખેડા: મોટેરા નોર્થ પ્લાઝાની નવી બનતી સાઈટ ઉપર રહેતા અને ત્યા જ કામ કરતા સંજયભાઈ સ/ઓ માવસીંગભાઈ પટેલ (ઉ.વ.૨૫) (મુળ વતન: રઈબાર તા:-લીમખેડા જી:-દાહોદ) તા.૧૨/૮/૧૮ બપોરના ૩/૪૫ વાગ્યાના સુમારે સાઈટ ઉપર પડી જતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૨/૯/૧૮ બપોરના ૩/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી જયાબેન લાલાભાઈ યલાવે છે.

ગણપતિ વિસર્જન કરતા ડુબી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૮૬૦/૧૮

રીવરફ્રન્ટ ઇસ્ટ: યુવરાજ અશ્વીનભાઈ સોલંકી (ઉ.વ.૧૫) (રહે.પ્રહલાદનગર ગાર્ડન પાસે વેજલપુર) તા.૨૧/૯/૧૮ સાંજના ૯/૨૫ વાગ્યાના સુમારે સાબરમતી નદી ઇન્દીરાબ્રીજ ખાતે સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જન માટે ગયા હતા ત્યારે પાણીમાં લપસી જતા ડુબી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ યલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૮૬૧/૧૮

ગાયકવાડ હવેલી: ઇકરા ડો/ઓ અફજલભાઈ વડનગરવાલા (ઉ.વ.૧૬) (રહે.અલઅહેમદી ફ્લેટ તાડની શેરી પાંચ પીપળી જમાલપુર) એ અગમ્ય કારણસર તા.૨૦/૯/૧૮ બપોરના ૪/૨૦ વાગે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને વા.સા.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૨/૯/૧૮ કલાક ૮/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એન.એસ.રાઠોડ યલાવે છે.

નારણપુરા: ધ્રુવકુમાર સોબરાજમલ ટેવાણી (ઉ.વ.૫૨) (રહે.એવરેસ્ટ ટાવર બીઆરટીએસ બસ સ્ટેન્ડ ટાવર સામે શાસ્ત્રીનગર) એ અગમ્ય કારણસર તા.૨૧/૯/૧૮ રાતના ૧૦/૨૦ વાગ્યા પહેલા પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારણપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી પ્રભાતસિંહ પરબતસિંહ યલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.